



The Co-Operative Bank of Rajkot Ltd.

Multi State Co-Operative Bank

Raj Bank

બોર્ડ મીટીંગ તા. ૧૭.૦૫.૨૦૨૫ ઠરાવ નં. ૧૧ થી મંજૂર થયેલ તા. ૦૧.૦૬.૨૦૨૫ થી લાગુ પડતા ધિરાણનાં વ્યાજના દરો

Minimum Interest Rate on Advances - 08.50 %
Maximum Interest Rate on Advances - 12.50 %

ધિરાણનાં વ્યાજના દરો

ક્રમ	ધિરાણનો પ્રકાર	ફ્લોટિંગ વ્યાજના દર (%)		ફિક્સ્ડ વ્યાજના દર (%)
૦૧	હોમ લોન (મહત્તમ મર્યાદા રૂ. ૨ કરોડ) CRA Score ૭૫૦ કે તેથી વધુ CRA Score ૭૦૦ થી ૭૪૯, -૧, No Score, ૧૦૦ થી ૩૦૦ CRA Score ૬૫૧ થી ૬૯૯ * બે કે તેથી વધુ એપ્લીકન્ટના કિસ્સામાં બધા એપ્લીકન્ટનો એવરેજ સ્કોર ગણવો.	(રૂ. ૧.૮૦ કરોડ સુધી) ૮.૫૦ % ૮.૭૫ % ૮.૨૫ %	(રૂ. ૧.૮૦ થી વધુ રૂ. ૨.૦૦ કરોડ સુધી) ૮.૦૦ % ૮.૨૫ % ૮.૭૫ %	૧૦.૦૦ %
૦૨	હોમ લોન ટોપ અપ (મહત્તમ મર્યાદા રૂ. ૭૫ લાખ) CRA Score ૭૫૦ કે તેથી વધુ CRA Score ૭૦૦ થી ૭૪૯, -૧, No Score, ૧૦૦ થી ૩૦૦ CRA Score ૬૫૧ થી ૬૯૯ * બે કે તેથી વધુ એપ્લીકન્ટના કિસ્સામાં બધા એપ્લીકન્ટનો એવરેજ સ્કોર ગણવો.	૮.૫૦ % ૮.૭૫ % ૧૦.૨૫ %		૧૧.૦૦ %
નોંધ : હોમ લોન તથા હોમ લોન ટોપ-અપ લોનનું કુલ એક્સ્પોઝર રૂ. ૨ કરોડથી વધવું જોઈશે નહીં.				
૦૩	વ્યક્તિગત હેતુ માટે વાહન લોન (મહત્તમ મર્યાદા રૂ. ૫૦ લાખ) (રૂ. ૧૫ લાખથી વધુની વાહન લોનના કિસ્સામાં કોલેટરલ સિક્યોરીટી લેવી ફરજિયાત છે.) (અરજદાર કે બે જામીન પૈકી કોઈપણ એક બેંકના ઓછામાં ઓછા એક વર્ષ જૂના સભાસદ હોવા જોઈએ.) CRA Score ૮૦૦ કે તેથી વધુ CRA Score ૭૫૦ થી ૭૯૯ CRA Score ૭૦૦ થી ૭૪૯, -૧, No Score, ૧૦૦ થી ૩૦૦ CRA Score ૬૫૧ થી ૬૯૯ * બે કે તેથી વધુ એપ્લીકન્ટના કિસ્સામાં બધા એપ્લીકન્ટનો એવરેજ સ્કોર ગણવો.	૮.૫૦ % ૮.૭૫ % ૮.૦૦ % ૮.૫૦ %		૧૦.૦૦ %
૦૪	વ્યક્તિગત હેતુ માટે સ્માર્ટ કેડીટ લોન (Non Real Estate) (મહત્તમ મર્યાદા રૂ. ૨૫ લાખ)	---		૧૧.૦૦ %
૦૫	જાતજામીન લોન (મહત્તમ મર્યાદા રૂ. ૧ લાખ)	---		૧૩.૦૦ %
૦૬	ગોલ્ડ લોન ગોલ્ડ સામે ઓવરડ્રાફ્ટ (મહત્તમ મર્યાદા રૂ. ૧.૭૫ લાખ) (મહત્તમ મર્યાદા રૂ. ૧૦ લાખ)	---		૮.૫૦ %
૦૭	NSC / KVP / LIC પોલીસી સામે લોન / ઓડી	---		૮.૫૦ %
૦૮	એફડી સામે ઓડી અને લોન ડીપોઝીટર માટે થર્ડ પાર્ટી માટે	---		એફડી રેટ+૧.૦૦% એફડી રેટ+૨.૦૦%
૦૯	સ્ટાફ લોન			પોલીસી પ્રમાણે

...૨...

📍 'Sahakar Sarita', Panchnath Road, Rajkot - 360 001 (Gujarat)

☎ 0281 - 2234454 / 2224120

📠 Fax: 0281 - 2236682

✉ info@tcbrl.com

🌐 tcbrl.com



Raj Bank

The Co-Operative Bank of Rajkot Ltd.

Multi State Co-Operative Bank

સ્મોલ લોન ધિરાણ માટે

ક્રમ	ધિરાણનો પ્રકાર	ફ્લોટિંગ વ્યાજના દર (%)
૧૦	- કેશ કેડીટ / સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ - કેશ કેડીટ/સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ એડહોક લીમીટ (સેક્શન લીમીટના ૨૫% સુધી) - બિઝનેસ લોન - ઇન્ડસ્ટ્રીયલ લોન - મશીનરી લોન - ફર્નીચર ફીક્સર લોન - સોલાર / રીન્યુએબલ એનર્જી લોન - લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટ લોન *નોંધ : નીચે દર્શાવેલ શરતોમાંથી કોઈપણ એક કે તેથી વધારે શરત પૂર્ણ હોય તો ઉપરોક્ત દર્શાવેલ તમામ પ્રોડક્ટમાં નવા ધિરાણમાં અને સીસી/ઓડીમાં રીન્યુઅલ સમયે દર્શાવેલ વ્યાજદરમાં ૦૦.૨૫%ની છૂટ મળવાપાત્ર રહેશે. ૧. ઇમ્યુએબલ સિક્યોરીટી ૧૫૦% કે તેથી વધુ હોય. ૨. એપ્લીકન્ટ કે તેના પ્રોપ્રાઇટર/પાર્ટનર/ડીરેક્ટરે બેંકમાંથી ધિરાણ લીધેલ હોય અને તેમાં છેલ્લા ૨ વર્ષ દરમિયાન ક્યારેય પણ ૧૦ દિવસથી વધારે ઓવરડ્યુ ન થયેલ હોય.	૮.૭૫ %*
૧૧	ધંધાકીય હેતુ માટે સ્માર્ટ કેડીટ લોન (Non Real Estate) (મહત્તમ મર્યાદા રૂા. ૧ કરોડ) *નોંધ : નીચે દર્શાવેલ શરતોમાંથી કોઈપણ એક કે તેથી વધુ શરત પૂર્ણ હોય તો નવા ધિરાણમાં વ્યાજદરમાં ૦૦.૨૫% ની છૂટ મળવાપાત્ર રહેશે. ૧. સિક્યોરીટીનું માર્જિન ૫૦% કે તેથી વધુ હોય. ૨. એપ્લીકન્ટે બેંકમાંથી ધિરાણ લીધેલ હોય અને તેમાં છેલ્લા ૨ વર્ષ દરમિયાન ક્યારેય પણ ૧૦ દિવસથી વધારે ઓવરડ્યુ ન થયેલ હોય. ૩. પ્રોફેશનલી ક્વોલીફાઇડ એપ્લીકન્ટ માટે (જેમકે ડોક્ટર/સીએ/સીએસ/આઈસીડબલ્યુએ/આર્કટિક વગેરે)	૧૦.૦૦ %*

પ્રોફેશનલ લોન / બિલ્ડર લોન ધિરાણ માટે

૧૨	ડોક્ટરો / હોસ્પિટલ માટે - ૧. મેડીકલ ઇક્વીપમેન્ટ (ઇન્સ્ટ્રુમેન્ટ માટે) ૨. બિઝનેસ લોન (હોસ્પિટલ બિલ્ડિંગ માટે) ૩. ફર્નીચર ફીક્સર લોન (હોસ્પિટલ માટે)	૮.૫૦ %
૧૩	બિલ્ડર કોન્ટ્રાક્ટરને કન્સ્ટ્રક્શન કરવા માટે ધિરાણ	૧૨.૫૦ %

કેડીટ રેટિંગ શીટના આધાર માટે

ક્રમ	ધિરાણનો પ્રકાર	ગ્રેડ	ફ્લોટિંગ વ્યાજના દર (%)
૧૪	- કેશકેડીટ અથવા સિક્યોર્ડ ઓવરડ્રાફ્ટ (બિઝનેસ માટે) - સીસી/એસઓડી/એડહોક લીમીટ એક્સ્પોઝર લીમીટની મર્યાદામાં (સેક્શન લીમીટના ૨૫% સુધી) - બિઝનેસ લોન - ઇન્ડસ્ટ્રીયલ લોન - મશીનરી લોન - ફર્નીચર ફીક્સર લોન - સોલાર / રીન્યુએબલ એનર્જી લોન - લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટ (Lease Rental Discount)	Grade- A Grade- B Grade- C Grade- D	૦૯.૦૦ % ૦૯.૫૦ % ૧૦.૦૦ % ૧૦.૫૦ %

નોંધ

- કોઈપણ ધિરાણની ચુકવણી કરતા પહેલા પ્રાથમિક દરખાસ્ત તથા તમામ પ્રકારના ડોક્યુમેન્ટ મેળવી મોર્ટગેજ રજીસ્ટર કરાવી અને ફાઇલ પૂર્ણ કર્યા બાદ જ ધિરાણની ચુકવણી કરવી. ખાસ કિસ્સામાં મોર્ટગેજ ધિરાણની ચુકવણી કર્યા બાદ કરવાનું હોય ત્યારે સેન્ટ્રલાઈઝડ ધિરાણ વિભાગની પરમીશન લેવી. આ પ્રકારના કિસ્સામાં ધિરાણ ચુકવ્યાના મહત્તમ ૧ (એક) માસના સમયમાં મોર્ટગેજ રજીસ્ટર કરાવવાનું કરજીયાત રહેશે.
- ધિરાણના વ્યાજના દરના સરકયુલરના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે બોર્ડ ઓફ ડીરેક્ટર્સ દ્વારા કરેલ નિર્ણય આખરી ગણવામાં આવશે અને નક્કી કરેલા વ્યાજના દરમાં ફેરફાર કરવાના પણ અધિકાર બોર્ડ ઓફ ડીરેક્ટર્સ પાસે રહેશે.

સ્થળ : રાજકોટ

તારીખ : ૨૯.૦૫.૨૦૨૫



જુલી સાવલીયા

ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર

© 'Sahakar Sarita', Panchnath Road, Rajkot - 360 001 (Gujarat)

☎ 0281 - 2234454 / 2224120

☎ Fax: 0281 - 2236682

☎ info@tcbrl.com

☎ tcbrl.com